

કાર્યો કરવા માટે નક્કી કરેલાં ધોરણો

આઈ-શાખા

વિવિધ પ્રવૃત્તિઓ/ કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નક્કી કરેલ ધોરણોની વિગતો.

૧. ઔદ્યોગિક નીતિના લાભ આપવા બાબત:-
સરકારી ઠરાવમાં નક્કી થયા મુજબની શરતો એકમ પૂરી કરે તો ઉદ્યોગ કમિશનરશ્રી કક્ષાએથી લાભ આપતા હુકમો કરવામાં આવે છે.
૨. ઉચ્ચકક્ષાની સમિતિમાં રજૂ કરવાના કેસ:-
પ્રથમ મુખ્ય સચિવકક્ષા સુધી વિવિધ કક્ષાએ કેસની ચકાસણી કર્યા બાદ એકમ ખરેખર મુશ્કેલીમાં હોય અને ઔદ્યોગિક નીતિમાં છૂટછાટ આપવાથી એકમ પુનઃ કાર્યરત થાય તેમ હોય તો આવી છૂટછાટ આપવા સબબ ભલામણ કરવા યોગ્ય કેસ છે કે કેમ તે બાબત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
૩. કચ્છ જિલ્લાના આર્થિક વિકાસની યોજનાના લાભ આપવા બાબત:-
સરકારી ઠરાવમાં નક્કી થયા મુજબની શરતો એકમ પૂરી કરે તો ઉદ્યોગ કમિશનરશ્રી કક્ષાએથી લાભ આપતા હુકમો કરવામાં આવે છે.
૪. ગંગાબા યાજ્ઞિક પુરસ્કાર યોજના :-
વિવિધ રીતે જાહેરાતો દ્વારા તથા અન્ય રીતે આ એવોર્ડ માટે યોગ્ય અરજીઓ મેળવીને તે પૈકી યોગ્ય ઉમેદવારની ભલામણ માટે તેઓની વિગતો સહ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યાર બાદ સમિતિની ભલામણો ધ્યાનમાં રાખી સરકાર કક્ષાએ નિર્ણય લેવામાં આવે છે.

“કાર્યો કરવા માટે નક્કી કરેલાં ધોરણો”

“છ અને છ-૧” શાખા

જુદા-જુદા પ્રકારની લીઝ મંજૂર કરવા સંબંધમાં સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીના મહેસુલી અહેવાલની અને તે પરત્વે કમિશનરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજના તાંત્રિક અહેવાલને આધારે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા માઇનીંગ લીઝ મંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જેમાં લીઝ વિસ્તાર, જમીનની ઉપલબ્ધી, ખનિજનો જથ્થો, અરજદારની નાણાકીય સધ્ધરતા, વિસ્તાર સંશોધિત થયેલ છે કે કેમ ? માંગણીવાળો વિસ્તાર જંગલ વિસ્તાર, અભ્યારણ કે રક્ષિત/અનામત જંગલ વિસ્તારમાં આવે છે કે કેમ ? વિસ્તારને અન્ય રીતે પ્રતિબંધિત કરાયો છે કે કેમ ? એપુલ્સ માઇનીંગ પ્લાન, માઇનીંગ એન્જીનીયરની નિમણૂક, સંશોધન ફી તથા સંશોધન ખર્ચ ભરપાઈ કરેલ છે કે કેમ ? તથા જરૂરી જણાય ત્યાં ભારત સરકારનું એન્વાયરમેન્ટ કલેક્ટરશ્રી સર્ટીફિકેટ મેળવવામાં આવ્યું છે કે કેમ ? વિગેરે બાબતોનાં ધોરણો ધ્યાને લેવામાં આવે છે.